



રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત

ખેલ મહાકુંભ ૨.૦

(ફોર્મ-અ)



વ્યક્તિગત રમત તથા સાંધિક રમત માટેનું પ્રવેશપત્ર (કોઈ પણ બે રમતમાં અને એકજ વયજૂથમાં ભાગ લઈ શકાશે) અં-૯ અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.		(ફોર્મ-અ)	
		KMK ID: _____	
		આધાર ડાયસ નંબર _____	
૧. શાળા/કોલેજ નું નામ*	_____		
૨. વય જૂથ* (૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ)	અં-૯	અં-૧૧	અં-૧૪
	અં-૧૭	ઓપન એજ ગ્રુપ	
			ભાઈઓ બહેનો
૩. રમતનું નામ* (પ્રથમ રમત)	_____ સબ ઈવેન્ટ* _____		
૪. રમતનું નામ* (બીજી રમત) (બે રમતમાં રજીસ્ટ્રેશન કરવા માટે)	_____ સબ ઈવેન્ટ* _____		
૧. ખેલાડીનું નામ*	_____		
૨. જન્મ તારીખ*	અટક	નામ	પિતાનું નામ
૫. મોબાઇલ નંબર* :	_____	_____	_____
૬. ઇ-મેઇલ આઇ.ડી* :	_____		
૭. વાલીનું નામ*:	અટક	નામ	પિતાનું નામ
૮. ઘરનું સરનામું*:	વાલીનો મોબાઇલ નંબર*:- _____		
૯. જિલ્લો/મહાનગરપાલિકા*	તાલુકો* : _____ ગામ:- _____		
૧૦. બેન્કની વિગત	બેન્કનું નામ:-..... બ્રાન્ચ:-..... એકાઉન્ટ નંબર..... IFSC કોડ:-.....		
૧૧. જાતી	<input type="checkbox"/> જનરલ	<input type="checkbox"/> ઓ.બી.સી	<input type="checkbox"/> એસ.સી
૧૨. કોચ/વ્યાયામ શિક્ષકનું નામ	_____		
૧૩. કોચ/વ્યાયામ શિક્ષકનાં ઘરનું સરનામું:	_____		
૧૪. કોચ/વ્યાયામ શિક્ષકનો મોબાઇલ નંબર:	_____		
નોંધ :-*ચિહ્ન કરેલી વિગતો ભરવી ફરજિયાત છે.			

રજીસ્ટ્રેશન અંગે સુચનાઓ

- અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
- ઓપન એજ ગ્રુપ, તથા અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન (૧) શાળા/કોલેજમાં (૨) જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર કચેરી (૩) વેબપોર્ટલ <https://khelmahakumbh.gujarat.gov.in> મારફતે કરાવવાનું રહેશે.

બાહેધરી:-

- સ્પર્ધા દરમિયાન કોઈ પણ જાતની શારીરિક હાની થશે તો તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈ જવાબદારી રહેશે નહીં.
- હું રજીસ્ટ્રેશન સમગ્ર રાજ્યમાંથી ફક્ત એક જ સ્થળેથી કરીશ અન્યથા મારું રજીસ્ટ્રેશન રદ બાતલ ગણાશે.
- હું _____ આથી બાહેધરી આપુ છું કે જો હું ખેલમહાકુંભમાં વિજેતા/પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચ અને જોખમે દર્શાવેલ સમય કરતાં પહેલાં ઉપસ્થિત રહીશ.
- વ્યક્તિગત રમત માટે ફોર્મ-અ અને સાંધિક રમત માટે ફોર્મ-અ અને ફોર્મ-બ ભરવું ફરજિયાત છે.
- ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમીન્ટન ડબલ્સ અને મિક્સ ડબલ્સ માટે ફોર્મ-બ ભરવાનું રહેશે.

તા. ___/___/૨૦૨૩

સ્થળ:- _____

ખેલાડીની સહી

વેબસાઇટ: <https://khelmahakumbh.gujarat.gov.in>



રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત
ખેલ મહાકુંભ ૨.૦



(ફોર્મ-બ)

સાંઘિક રમત માટે ટીમની યાદીનું પ્રવેશ પત્ર
(કોઈ પણ બે રમતમાં ભાગ લઈ શકાશે)

૧. ટીમનું નામ/શાળાનું નામ / કોલેજ/સંસ્થાનું નામ/ ડબલ્સ અને મિક્સ ડબલ્સ માટેના નામ	:	_____
૨. વયજૂથ	:	_____
૩. રમતનું નામ	:	_____
૪. સંપર્ક નંબર	:	_____
૫. ખેલાડીના નામ	:	નામ પિતાનું નામ અટક જન્મ તારીખ ઇમેઇલ મોબાઇલ નં જાતી
		૧. _____
		૨. _____
		૩. _____
		૪. _____
		૫. _____
		૬. _____
		૭. _____
		૮. _____
		૯. _____
		૧૦. _____
		૧૧. _____
		૧૨. _____
		૧૩. _____
		૧૪. _____
		૧૫. _____
		૧૬. _____
૬. કોચ/વ્યાયામ શિક્ષકનું નામ	:	_____
૭. કોચ/વ્યાયામ શિક્ષક મોબાઇલ નં	:	_____

બાહેંધરી:-

- સ્પર્ધા દરમિયાન કોઈ પણ જાતની શારીરિક હાની થશે તો તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈ જવાબદારી રહેશે નહીં.
- હું રજિસ્ટ્રેશન સમગ્ર રાજ્યમાંથી ફક્ત એકજ સ્થળેથી કરીશ અન્યથા મારું રજિસ્ટ્રેશન રદબાતલ ગણાશે.
- હું _____ આથી બાહેંધરી આપુ છું કે જો હું ખેલમહાકુંભમાં વિજેતા/પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચે અને જોખમે દર્શાવેલ સમય કરતાં પહેલાં ઉપસ્થિત રહીશ.
- દરેક સાંઘિક જ રમત માટે ફોર્મ-બ ભરવું ફરજિયાત છે.

તા.____/____/૨૦૨૩

સ્થળ:- _____

ખેલાડીની સહી

અંક ૨ ૯ (તા.૦૧/૦૧/૨૦૧૫ અને તે પછી જન્મેલા)	
(જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૩૦ મીટર <input type="checkbox"/> સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ
અંક ૨ ૧૧ (તા.૦૧/૦૧/૨૦૧૩ અને તે પછી જન્મેલા)	
(જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૫૦ મીટર <input type="checkbox"/> સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ
સીધી તાલુકા / ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
ચેસ	<input type="checkbox"/> ચેસ
સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મીટર <input type="checkbox"/> લાંબી કૂદ
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રીંક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૨ (૧૦૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રીંક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૪ (૧૦૦૦ મી.)
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ
વેડમીન્ટન	<input type="checkbox"/> સીગલ્સ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીગલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીગલ્સ
સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
સ્વીમીંગ	વ્યક્તિગત મીડલે (૨૦૦ મીટર)
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રોડ ૧ (૧૫૦૦ મી)
	ઈનલાઈન <input type="checkbox"/> રોડ ૨ (૫૦૦મી) <input type="checkbox"/> રોડ રેસ ૩ (૧૫૦૦મી)
અંક ૨ ૧૪ (તા.૦૧/૦૧/૨૦૧૦ અને તે પછી જન્મેલા)	
સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦મીટર <input type="checkbox"/> લાંબીકૂદ <input type="checkbox"/> ગોળા કૂંક
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ
ખો-ખો	<input type="checkbox"/> ખો-ખો
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૫૧ કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૪૮ કિગ્રા)
સીધી તાલુકા / ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦ મીટર <input type="checkbox"/> ૪૦૦ મીટર <input type="checkbox"/> ૬૦૦ મીટર <input type="checkbox"/> ઉચીકૂદ <input type="checkbox"/> ચક્રકૂંક
ચેસ	<input type="checkbox"/> ચેસ
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)
સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
યોગાસન	<input type="checkbox"/> આર્ટિસ્ટિક યોગા(ટ્રિક્સ) <input type="checkbox"/> રિધમીક યોગા
આર્ચરી	<input type="checkbox"/> ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરબોલ)
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી.
	<input type="checkbox"/> ૪૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૨૦૦ મી.
આર્ટિસ્ટીક સ્કેટીંગ	<input type="checkbox"/> ફ્રી સ્કેટીંગ <input type="checkbox"/> સોલોડાન્સ <input type="checkbox"/> ફ્રીગર <input type="checkbox"/> ક્વોટ્ટ
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રીંક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૨ (૧૦૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રીંક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૪ (૧૦૦૦ મી.)
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૨૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૫-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૨૩ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૩-૨૭ કિગ્રા <input type="checkbox"/> ૨૭-૩૨ કિગ્રા <input type="checkbox"/> ૩૨-૩૬ કિગ્રા
કુસ્તી	ભાઈઓ <input type="checkbox"/> ૩૦-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૧ કિગ્રા <input type="checkbox"/> ૪૧-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૨૬-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૩ કિગ્રા <input type="checkbox"/> ૩૩-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૩૯ કિગ્રા <input type="checkbox"/> ૩૯-૪૨ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૧૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૮-૨૧ કિગ્રા <input type="checkbox"/> ૨૩-૨૫ કિગ્રા <input type="checkbox"/> ૨૭-૨૯ કિગ્રા <input type="checkbox"/> ૪૧ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૧૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૮-૨૦ કિગ્રા <input type="checkbox"/> ૨૨-૨૪ કિગ્રા <input type="checkbox"/> ૨૬-૨૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮ કિગ્રાથી ઉપર
વેડમીન્ટન	<input type="checkbox"/> સીગલ્સ
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીગલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીગલ્સ
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ
હોકી	<input type="checkbox"/> હોકી
કુટબોલ	<input type="checkbox"/> કુટબોલ
કરાટે	ભાઈઓ <input type="checkbox"/> ૨૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૦-૨૫ કિગ્રા <input type="checkbox"/> ૨૫-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૧૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૮-૨૨ કિગ્રા <input type="checkbox"/> ૨૨-૨૪ કિગ્રા <input type="checkbox"/> ૨૪-૨૬ કિગ્રા <input type="checkbox"/> ૨૬-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૪ કિગ્રા <input type="checkbox"/> ૩૪-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦ કિગ્રાથી ઉપર

નોંધ:- યોગાસન માટે,
 > ગ્રુપ-A પશ્ચિમોત્તરસન, સર્વોગસન, મત્સ્યાસન, અર્ધમત્સ્યાસન, પૂર્ણ પનુરાસન, ઉત્તાન પાદાસન
 > ગ્રુપ-B પૂર્ણ ચક્રાસન, કુકુટાસન, ભુમાસનપૂર્ણ, સલભાસન, બકાસન, શિર્ષાસન
 > ગ્રુપ-C સાંખ્યાસન, વ્યાધાસન, ઉર્ધ્વ કુકુટાસન, ઉત્તિચતિતિવાસન, પદ્મ મથુરાસન, ઉત્તિચાપાદસ્તાસન
 > સ્વચ્છકક્ષાએ વેસ્ટ એક ધ બેસ્ટ રમાશે.

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે
 > યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
 > બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
 > એથલેટીક્સ રમતમાં વધુમાં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
 > સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
 > જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં કવોડ અથવા ઇનલાઇન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
 > કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કરાટે અને જુડોની રમતમાં કોઇ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.
 > કુસ્તી, ટેકવેન્ડો, અને જુડોની રમતમાં કોઇ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.

સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૮૦ મી હર્ડલ્સ <input type="checkbox"/> ૪ x ૧૦૦ મી રીલે
સ્વીમીંગ	<input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ ૫૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ રીલે ૪ x ૧૦૦મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> મીડલે રીલે ૪ x ૧૦૦મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બટરફ્લાય સ્ટ્રોક ૨૦૦મી
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦ કિગ્રા થી ઉપર બહેનો <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪ કિગ્રા થી ઉપર
કુસ્તી	ભાઈઓ <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૫ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૪૨-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૫૮-૬૨ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૨૧-૨૩ કિગ્રા <input type="checkbox"/> ૨૫-૨૭ કિગ્રા <input type="checkbox"/> ૨૯-૩૨ કિગ્રા <input type="checkbox"/> ૩૨-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૧ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૧૬-૧૮ કિગ્રા <input type="checkbox"/> ૨૦-૨૨ કિગ્રા <input type="checkbox"/> ૨૪-૨૬ કિગ્રા <input type="checkbox"/> ૨૯-૩૨ કિગ્રા <input type="checkbox"/> ૩૨-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા
જીમ્નાસ્ટીક	ભાઈઓ <input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> રોમનરૈન્જ <input type="checkbox"/> પેરલલબાર <input type="checkbox"/> પોમેલહોર્સ <input type="checkbox"/> હોરિજોન્ટલબાર બહેનો <input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> બેલેસીંગબીમ <input type="checkbox"/> અનઈવનબાર <input type="checkbox"/> હૂપ(રિધમીક) <input type="checkbox"/> ક્લબ(રિધમીક) <input type="checkbox"/> બોલ(રિધમીક) <input type="checkbox"/> રોપ(રિધમીક) <input type="checkbox"/> રીબન (રિધમીક)
સ્કેટીંગ	ફ્લોડ <input type="checkbox"/> રોડ ૧ (૨૦૦૦ મી.) ઈનલાઈન <input type="checkbox"/> રોડ ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> રોડ ૩ (૨૦૦૦ મી.)
આર્ચરી	રીકર્વ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરઓલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્ષ ટીમ કમ્પાઉન્ડ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરઓલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્ષ ટીમ
શુટીંગ	<input type="checkbox"/> ૧૦ મી.એર પીસ્તોલ <input type="checkbox"/> ૧૦ મી. એર રાયફલ પીપ <input type="checkbox"/> ૧૦ મી. ઓપન સાઇટ એર રાયફલ
ટેન્સીસ	<input type="checkbox"/> ગ્રોઇલ <input type="checkbox"/> ઈપી <input type="checkbox"/> સેબર
બોક્સીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૨૮-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૨ કિગ્રા <input type="checkbox"/> ૩૨-૩૪ કિગ્રા <input type="checkbox"/> ૩૪-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા
મલાખંસ	<input type="checkbox"/> રોપ મલાખંસ (ફક્ત બહેનો માટે) <input type="checkbox"/> પોલ મલાખંસ (ફક્ત ભાઈઓ માટે)
રોલબોલ	<input type="checkbox"/> રોલબોલ
સેપક ટકરાવ	<input type="checkbox"/> ટીમ ઇવેન્ટ
સ્પોર્ટ્સ ક્લામીંગ	<input type="checkbox"/> લીડ ક્લામીંગ <input type="checkbox"/> સ્પીડ ક્લામીંગ <input type="checkbox"/> બોલરૈન્જ

> જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

> જીમ્નાસ્ટીક સ્પર્ધામાં કલ્પના નિયમ પ્રમાણે ભાઈઓએ ૬ (છ) પેરા રમત અને બહેનોએ ૪ (ચાર) પેરા રમતમાં ભાગ લેવાનો રહેશે.

> શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની રાઈફલ લાવવાની રહેશે. ત્રણમાંથી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

> શુટીંગ સ્પર્ધામાં એર પીસ્તોલની એક અથવા એર રાયફલ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

ખેલમહાકુંભ ૨.૦

અંક ૧૭ (તા.૦૧/૦૧/૨૦૦૭ અને તે પછી જન્મેલા)	
જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મી. <input type="checkbox"/> લાંબીફેદ <input type="checkbox"/> લંગડીશન કુદ <input type="checkbox"/> ગોળાફેક
રસ્સાબંધ	<input type="checkbox"/> ભાઈઓ ૪૮૦ કિગ્રા <input type="checkbox"/> બહેનો ૪૦૦ કિગ્રા નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ
ખો-ખો	<input type="checkbox"/> ખો-ખો
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૫૫ કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૫૫ કિગ્રા)
સીધી તાલુકા/ઝોનકક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦મી <input type="checkbox"/> ૪૦૦મી <input type="checkbox"/> ૮૦૦ મી <input type="checkbox"/> ૧૫૦૦ મી. <input type="checkbox"/> ઉર્થફેદ <input type="checkbox"/> બરછીફેક <input type="checkbox"/> ચક્રફેક
ચેસ	<input type="checkbox"/> ચેસ
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)
સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
આર્ચરી	<input type="checkbox"/> ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરઓલ)
યોગાસન	<input type="checkbox"/> આર્થિસ્ટિક યોગા(ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિધમીક યોગા
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી. <input type="checkbox"/> ૪૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૨૦૦ મી.
સ્કેટીંગ	ફ્લોડ <input type="checkbox"/> રીક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૨(૧૦૦૦ મી.) ઈનલાઈન <input type="checkbox"/> રીક ૩(૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૪(૧૦૦૦ મી.)
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા બહેનો <input type="checkbox"/> ૩૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા
કુસ્તી	ભાઈઓ-ફ્રીસ્ટાઇલ <input type="checkbox"/> ૪૧-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા બહેનો-ફ્રીસ્ટાઇલ <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૩ કિગ્રા <input type="checkbox"/> ૪૩-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૩ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૪૧-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૯ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રા થી ઉપર બહેનો <input type="checkbox"/> ૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૮-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૮ કિગ્રા થી ઉપર
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ
હોકી	<input type="checkbox"/> હોકી
કુટબોલ	<input type="checkbox"/> કુટબોલ
કરાટે	ભાઈઓ <input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૫૮-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા <input type="checkbox"/> ૭૪-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮-૮૨ કિગ્રા <input type="checkbox"/> ૮૨ કિગ્રા થી ઉપર બહેનો <input type="checkbox"/> ૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૨-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૬ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૪ કિગ્રા <input type="checkbox"/> ૬૪-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮ થી ઉપર
રઝબી	<input type="checkbox"/> રઝબી

નોંધ:- યોગાસન માટે,

- > ગ્રુપ-A પશ્ચિમોત્તાસન, સર્વાંગાસન, મનસ્વાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, પૂર્ણ ધનુરાસન, ઉત્થાન પાદાસન
- > ગ્રુપ-B પૂર્ણ ચક્રાસન, કુકુલાસન, ભુમાસનપૂર્ણ, સલભાસન, બક્ષાસન, શિર્ષાસન
- > ગ્રુપ-C સાંખ્યાસન, વ્યાધાસન, ઉર્ધ્વ કુકુરાસન, ઉત્તિશ્ચાતિતિવાસન, પદ્મ મથુરાસન, ઉત્તિશ્ચાદેવતાસન
- > રાજ્યકક્ષાએ બેસ્ટ એક ધ બેસ્ટ રમાશે.

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે

- > યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૩ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- > બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
- > યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૩ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- > બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
- > એથલેટીક્સ રમતમાં વધુ માં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- > સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
- > જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં ફ્લોડ અથવા ઇનલાઈન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
- > કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કરાટે અને જુડોની રમતમાં કોઈ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.

સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૩૦૦૦ મી <input type="checkbox"/> ૧૦૦ મી હર્ડલ્સ <input type="checkbox"/> ૪ x ૧૦૦ મી રીલે <input type="checkbox"/> વાસફૂટ <input type="checkbox"/> હથોડા ફેક <input type="checkbox"/> ૫ કી.મી.વોક(બહેનો) <input type="checkbox"/> ૩ કી.મી.વોક(બહેનો) <input type="checkbox"/> ૪૦૦ મી હર્ડલ્સ
સ્વીમીંગ	<input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ ૫૦મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બટરફ્લાય સ્ટ્રોક ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ ૮૦૦મી (ભાઈઓ)
	<input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૪૦૦ મી <input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ ૨૦૦મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૫૦મી <input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ રીલે ૪ x ૧૦૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી
	<input type="checkbox"/> બટર ફ્લાય ૫૦મી <input type="checkbox"/> મીડલે રીલે ૪ x ૧૦૦ મી
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૬૦-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૩ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૧-૯૦ કિગ્રા <input type="checkbox"/> ૯૦ કિગ્રા થી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૫૨-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦ કિગ્રા થી ઉપર
કુસ્તી	ભાઈઓ (ફ્રીસ્ટાઇલ) <input type="checkbox"/> ૬૦-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૧-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦-૯૨ કિગ્રા <input type="checkbox"/> ૯૨-૧૧૦ કિગ્રા
	બહેનો (ફ્રીસ્ટાઇલ) <input type="checkbox"/> ૫૩-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૧-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૬૯ કિગ્રા <input type="checkbox"/> ૬૯-૭૩ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૩૮-૪૧ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૩ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૭૮ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૩૨-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૯ કિગ્રા <input type="checkbox"/> ૫૯-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા
જીમ્નાસ્ટીક	ભાઈઓ <input type="checkbox"/> ફ્લોર એક્સાઇઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> રોમનરીંગ <input type="checkbox"/> પેરલલબાર <input type="checkbox"/> પોમોલોસ <input type="checkbox"/> હોરિજન્ટલબાર
	બહેનો <input type="checkbox"/> ફ્લોર એક્સાઇઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> બેલેસીંગબીમ <input type="checkbox"/> અનઈવનબાર <input type="checkbox"/> હૂપ(રિધમીક) <input type="checkbox"/> ક્લબ(રિધમીક) <input type="checkbox"/> બોલ(રિધમીક) <input type="checkbox"/> રોપ(રિધમીક) <input type="checkbox"/> રીબન (રિધમીક)
સ્કેટીંગ	ફ્વોડ <input type="checkbox"/> રોડ રેસ ૩ (૩૦૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રોડ રેસ ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> રોડ રેસ ૩ (૩૦૦૦ મી.)
આર્ચરી	રીકર્વ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરશોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
શૂટીંગ	કમ્પાઉન્ડ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરશોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
વેઇટલીફ્ટીંગ	<input type="checkbox"/> ૧૦ મી.એર પીસ્ટોલ <input type="checkbox"/> ૧૦ મી.પી.પી.પી સાઈટ એર રાયફલ <input type="checkbox"/> ૧૦ મી. ઓપન સાઈટ એર રાયફલ
વેઇટલીફ્ટીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૪૯ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૭ કિગ્રા <input type="checkbox"/> ૭૩ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૯૬ કિગ્રા <input type="checkbox"/> ૧૦૨ કિગ્રા <input type="checkbox"/> ૧૦૨ કિગ્રા થી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૯ કિગ્રા <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૯ કિગ્રા <input type="checkbox"/> ૬૫ કિગ્રા <input type="checkbox"/> ૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૬ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા થી ઉપર
ટેન્સીંગ	<input type="checkbox"/> કોઈલ <input type="checkbox"/> ઈપી <input type="checkbox"/> સેબર
બોક્સીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૪૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૬૦-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦ કિગ્રાથી ઉપર
મલાખલ	ભાઈઓ <input type="checkbox"/> ૪૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦ થી ઉપર
રોલબોલ	<input type="checkbox"/> રોલબોલ
સેપક ટકરાવ	<input type="checkbox"/> ટીમ ઇવેન્ટ
સ્પોર્ટ્સ ક્લામીંગ	<input type="checkbox"/> લીડ ક્લામીંગ <input type="checkbox"/> સ્પીડ ક્લામીંગ <input type="checkbox"/> બોલ્ડરીંગ
સોકર ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ
વુડબોલ	ફેરપ્લે <input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> ટીમ
	સ્ક્રોક <input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> ટીમ

> જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

> જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ૬૬૫ ના નિયમ પ્રમાણે ભાઈઓએ ૬ (છ) પેટા રમત અને બહેનોએ ૪ (ચાર) પેટા રમતમાં ભાગ લેવાનો રહેશે.

> શૂટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શૂટીંગ માટે પોતાની રાઈફલ લાવવાની રહેશે.

ત્રણમાંથી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

> શૂટીંગ સ્પર્ધામાં એર પીસ્ટોલની એક અથવા એર રાયફલ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

ખેલમહાકુંભ ૨૦

ઓપન એઈજ ગ્રુપ (તા.૩૧/૧૨/૨૦૦૬ અને તે પહેલા જન્મેલા)	
જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
સીધી ગ્રામ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મી. <input type="checkbox"/> લાંબીફૂટ <input type="checkbox"/> લંગડીફાળ ફૂટ <input type="checkbox"/> ગોળાફેક
રસ્સાખેંચ	<input type="checkbox"/> ભાઈઓ ૫૨૦ કિગ્રા <input type="checkbox"/> બહેનો ૪૪૦ કિગ્રા નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૮૫ કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૭૫ કિગ્રા)
ખો-ખો	<input type="checkbox"/> ખો-ખો
સીધી તાલુકા / ઝોનકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦મી <input type="checkbox"/> ૪૦૦મી <input type="checkbox"/> ૮૦૦ મી <input type="checkbox"/> ૧૫૦૦ મી. <input type="checkbox"/> ૩૦૦૦ મી <input type="checkbox"/> ઉર્થાકુદ <input type="checkbox"/> બરછીફેક <input type="checkbox"/> ચક્રફેક
ચેસ	<input type="checkbox"/> ચેસ
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસન)
સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા	
શૂટીંગ બોલ	<input type="checkbox"/> ફક્ત ભાઈઓ માટે
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ
યોગાસન	<input type="checkbox"/> આર્થિસ્ટિક યોગા(ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિધમીક યોગા (નોંધ:- યોગાસનમાં ખેલાડી બારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.)
કુટબોલ	<input type="checkbox"/> કુટબોલ
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ
હોકી	<input type="checkbox"/> હોકી
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી.
	<input type="checkbox"/> ૪૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૨૦૦ મી.
આર્ટીસ્ટીક સ્કેટીંગ	<input type="checkbox"/> ફ્રી સ્કેટીંગ <input type="checkbox"/> સોલોડાન્સ <input type="checkbox"/> ફ્રીગર
સ્કેટીંગ	ફ્વોડ <input type="checkbox"/> રીક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૨ (૧૦૦૦ મી.)
	ઈન લાઈન <input type="checkbox"/> રીક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૪ (૧૦૦૦ મી.)
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૩ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૪૪ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૭ કિગ્રા
કુસ્તી	ભાઈઓ <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૩ કિગ્રા <input type="checkbox"/> ૫૩-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૯ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૩ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૨-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા
આર્ચરી	<input type="checkbox"/> ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરશોલ)
કરાટે	ભાઈઓ <input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૫૮-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૨-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૬ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૪ કિગ્રા <input type="checkbox"/> ૬૪-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮ થી ઉપર

નોંધ:- યોગાસન માટે,

- ગ્રુપ-A પશ્ચિમોતાસન, સર્વાંગાસન, મત્સ્યાસન, અર્ધમત્સ્યાસન, પુર્ણ ધનુરાસન, ઉત્તન પાદાસન
- ગ્રુપ-B પુર્ણ ચક્રાસન, કુકુટાસન, લુમાસનપુર્ણ, સલભાસન, બકાસન, શિર્ષાસન
- ગ્રુપ-C સાંખ્યાસન, વ્યાયાસન, ઉર્ધ્વ કુકુટાસન, ઉત્તિથતિવાસન, પદ્મ મથુરાસન, ઉત્તિથતિવાસન
- રાજવક્રાએ બેસ્ટ એક ધ વેસ્ટ રમ્પાશે.

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે

- યોગાસનમાં ખેલાડી બારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
- એથલેટીક્સ રમતમાં વધુ માં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
- જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં કવોડ અથવા ઇનલાઈન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
- કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કરાટે અને જુડો રમતમાં કોઈ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.
- બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઇવેન્ટમાંથી કોઈ પણ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

રચ્ખી	<input type="checkbox"/> રચ્ખી
❖ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૫૦૦૦મી <input type="checkbox"/> ૧૧૦ મી હર્ડલ્સ ભાઈઓ <input type="checkbox"/> ૧૦૦ મી. હર્ડલ્સ(બહેનો) <input type="checkbox"/> ૪૦૦મી હર્ડલ્સ <input type="checkbox"/> ૪ x ૧૦૦મી. રીલે <input type="checkbox"/> ૪ x ૪૦૦ મી.રીલે <input type="checkbox"/> વાંસફૂદ <input type="checkbox"/> હથોડા ફેક
સ્વીમીંગ	<input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૫૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૮૦૦મી બહેનો <input type="checkbox"/> ફ્રીસ્ટાઈલ ૧૫૦૦ મી ભાઈઓ <input type="checkbox"/> ફ્રીસ્ટાઈલ રીલે ૪ x ૧૦૦મી.
	<input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય ૫૦મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૨૦૦ મી
	<input type="checkbox"/> બેક સ્ટોક ૫૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> મીડલે રીલે ૪ x ૧૦૦મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૪૦૦ મી
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૭૩-૮૧ કિગ્રા સુધી <input type="checkbox"/> ૮૧-૯૦ કિગ્રા <input type="checkbox"/> ૯૦-૧૦૦ કિગ્રા <input type="checkbox"/> ૧૦૦ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૫૭-૬૩ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૩-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રા થી ઉપર
કુસ્તી	ભાઈઓ <input type="checkbox"/> ૭૪-૭૯ કિગ્રા <input type="checkbox"/> ૭૯-૮૬ કિગ્રા <input type="checkbox"/> ૮૬-૯૨ કિગ્રા <input type="checkbox"/> ૯૨-૯૭ કિગ્રા <input type="checkbox"/> ૯૭-૧૨૫ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૫૯-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૨ કિગ્રા <input type="checkbox"/> ૭૨-૭૬ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૪૦-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૨ કિગ્રા
આર્ચરી	રીકર્વ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરચોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્ષ ટીમ
	કમ્પાઉન્ડ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરચોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્ષ ટીમ
જીમ્નાસ્ટીક	ભાઈઓ <input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> રોમનરીંગ <input type="checkbox"/> પેરલલબાર <input type="checkbox"/> પોમેલહોસ્ટ <input type="checkbox"/> હોરિજન્ટલબાર
	બહેનો <input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> બેલેસીંગબીમ <input type="checkbox"/> અન ઈવનબાર
સ્કેટીંગ	સ્કોડ <input type="checkbox"/> રોડ ૧ (૩૦૦૦ મી.)
	ઈન લાઈન <input type="checkbox"/> રોડ ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> રોડ ૩ (૩૦૦૦ મી.)
સાઈકલીંગ	<input type="checkbox"/> ૨૦ કી.મી.
શુટીંગ	રાઇફલ ગ્રુપ <input type="checkbox"/> ૧૦ મી. એર રાયફલ પીપ <input type="checkbox"/> ૫૦ મી. ૦.૨૨ રાઇફલ ૩ પોજિશન
	પિસ્તોલ ગ્રુપ <input type="checkbox"/> ૧૦ મી. એર પિસ્તોલ <input type="checkbox"/> ૦.૨૨ રેપીડ ફાયર (ભાઈઓ) <input type="checkbox"/> ૦.૨૨ સ્પોર્ટ્સ પિસ્તોલ (બહેનો)
	ટ્રેપ ગ્રુપ <input type="checkbox"/> શોટગન ટ્રેપ <input type="checkbox"/> શોટગન ડબલ ટ્રેપ
વેઈટલીફ્ટીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૭ કિગ્રા <input type="checkbox"/> ૭૩ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૯ કિગ્રા <input type="checkbox"/> ૯૬ કિગ્રા <input type="checkbox"/> ૧૦૨ કિગ્રા <input type="checkbox"/> ૧૦૯ કિગ્રા <input type="checkbox"/> ૧૦૯ કિગ્રા થી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૯ કિગ્રા <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૯ કિગ્રા <input type="checkbox"/> ૬૪ કિગ્રા <input type="checkbox"/> ૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૬ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૭ કિગ્રા <input type="checkbox"/> ૮૭ કિગ્રા થી ઉપર
ફેન્સીંગ	<input type="checkbox"/> ફોઈલ <input type="checkbox"/> ઈપી <input type="checkbox"/> સેબર
બોક્સીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩.૫ કિગ્રા <input type="checkbox"/> ૬૩.૫-૬૭ કિગ્રા <input type="checkbox"/> ૬૭-૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૧-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા
બીચ હેન્ડબોલ	<input type="checkbox"/> બીચ હેન્ડબોલ
બીચ વોલીબોલ	<input type="checkbox"/> બીચ વોલીબોલ
ઘોડેસવારી	<input type="checkbox"/> જમ્પીંગ (ભાઈઓ) <input type="checkbox"/> એન્સ્યુરન્સ (ભાઈઓ)
મલાખંભ	<input type="checkbox"/> રોપ મલાખંભ (ફકત બહેનો માટે) <input type="checkbox"/> પોલ મલાખંભ (ફકત ભાઈઓ માટે)
સોકર ટેનીસ	<input type="checkbox"/> સીગલ્સ <input type="checkbox"/> ડબલ્સ
સ્પોર્ટ્સ ક્લામીંગ	<input type="checkbox"/> લીડ ક્લામીંગ <input type="checkbox"/> સ્પીડ ક્લામીંગ <input type="checkbox"/> બોલરોંગ
વડબોલ	ફેરપ્લે <input type="checkbox"/> સીગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> ટીમ
	સ્ટ્રોક <input type="checkbox"/> સીગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> ટીમ

➢ શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની રાઈફલ લાવવાની રહેશે.
 ➢ બધી જ સ્પર્ધાઓ ઈન્ટર નેશનલ શુટીંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF)ના નિયમો મુજબ યોજાશે
 ➢ શુટીંગ સ્પર્ધામાં રાઈફલ અથવા પિસ્તોલ અને ટ્રેપ ગ્રુપમાં કોઇપણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

બેલમહાકુંભ ૨.૦

૪૦ વર્ષથી ઉપર (તા.૦૧/૦૧/૧૯૬૪ થી તા.૩૧/૧૨/૧૯૮૩ દરમ્યાન જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
❖ સીધી ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖	
રસ્સાખેંચ	<input type="checkbox"/> ભાઈઓ ૫૬૦ કિગ્રા <input type="checkbox"/> બહેનો ૪૮૦ કિગ્રાનોંધ: (૮ બેલાડીઓનું કુલ વજન)
❖ સીધી તાલુકા/ઝોનકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖	
ચેસ	<input type="checkbox"/> ચેસ નોંધ:- અબોવ-૪૦ અને અબોવ-૬૦ માટે બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઇવેન્ટમાંથી કોઈ પણ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
❖ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
શુટીંગ બોલ	<input type="checkbox"/> ફકત ભાઈઓ માટે
બેડમીન્ટન	<input type="checkbox"/> સીગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
સ્વીમીંગ	<input type="checkbox"/> ૫૦ મી.ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૫૦ મી બેક સ્ટ્રોક
	<input type="checkbox"/> ૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૫૦મી.બટર ફ્લાય સ્ટ્રોક
<input type="checkbox"/> સ્વીમીંગ રમતમાં કોઇપણ ૩ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.	
❖ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖	
યોગાસન	<input type="checkbox"/> કોમ્બીનેશન યોગ ચેમ્પીયન શીપ

નોંધ:-યોગાસન માટે (રાજ્યકક્ષા)
 અબોવ-૪૦ માં માત્ર એક જ ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે.
 ➢ આગળ જુકવાનું આસન:- પશ્ચિમોતાસન, ભુમાસન, ઉત્થિતપાદઆસન, કુર્માસન, યોગાસન
 ➢ પાછળ જુકવાનું આસન:- ચક્રાસન, ધનુરાસન, ઉષ્ટ્રાસન, ભુંજગાસન, સેતુબંધાઅસન
 ➢ કમળને વળાંક આપતું આસન:-પૂર્ણમત્તેન્દ્રઆસન, કમરમરોડાસન, વકાસન, હાથનું સમતુલન આસન, પગનું સમતુલન આસન

૬૦ વર્ષથી ઉપર (તા.૩૧/૧૨/૧૯૬૩ અને તે પહેલા જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

❧ સીધી ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❧

રસ્સાખેંચ ભાઈઓ ૬૨૦ કિગ્રા બહેનો ૪૮૦ કિગ્રા નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)

❧ સીધી તાલુકા / ઝોન કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❧

ચેસ ચેસ

❧ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❧

બેડમીન્ટન સીંગલ્સ ડબ્લ્સ મિક્સ ડબ્લ્સ

ટેબલ ટેનીસ સીંગલ્સ ડબ્લ્સ મિક્સ ડબ્લ્સ

લોન ટેનીસ સીંગલ્સ ડબ્લ્સ મિક્સ ડબ્લ્સ

સ્વીમીંગ ૫૦ મી. ફી સ્ટાઈલ ૧૦૦ મી. ફી સ્ટાઈલ ૫૦ મી બેક સ્ટ્રોક

૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી. બટર ફ્લાય સ્ટ્રોક

નોંધ: યોગાસન માટે (રાજ્યકક્ષા)

અબોવ-૬૦ માં માત્ર એક જ ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે. ૫ આસનો કરવાના રહેશે. આગળ જુકવાનું આસન, પાછળ જુકવાનું આસન, કમળને વળાંક આપતું આસન, હાથનું સમતુલન આસન, પગનું સમતુલન આસન

સ્વીમીંગ રમતમાં કોઈપણ ૩ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

❧ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❧

યોગાસન કોમ્બીનેશન યોગ ચેમ્પીયન શીપ